

# હાદી માસિક

બાળકો અને  
નવયુવાનો માટે

જમાદીઉલ અવ્વલ, દીજરી સન ૧૪૩૨,  
એપ્રિલ - ૨૦૧૧



રૂ.  
30/-



# અલ્લાહના લોક નામો

## અલ - અદલો

# الْعَدْل

અલ્લાહ તબારક - વ - તઆલાનો આ ગુણ અલ્લાહની અદાલત સાથે સંબંધ ધરાવે છે. આ ગુણના ઘણા અર્થ થાય છે, જેમાંથી કેટલાંક અગત્યના અર્થ નીચે મુજબના છે :

**અગત્યના અર્થ :**

(૧) પુરેપુરુ વળતર આપનાર (૨) સર્વશ્રેષ્ઠ ન્યાય કરવાવાળો

**આ ગુણ અંગેનું કુરઆનમાં દેખાંત :**

પરવરદિગારે આલમના આ ગુણનો કુરઆનમાં વિપુલ પ્રમાણમાં પ્રયોગ થયો છે, ઘણી જગ્યાએ ખુદાવન્દે આલમે પોતાની જાતને આ ગુણ સાથે વર્ણવી છે, દા.ત. ઈરશાદે ઈલાહી “**વતમ્મત કલેમતો રબ્બેકા રિદકૌ - વ - અદલા...**”

**અનુવાદ :** અને તમારા પરવરદિગારની વાત સચ્ચાઈ સાથે પરીણામ સુધી પહોંચી.

**માઅસૂમીન અ.સ.ની વાણી :** માઅસૂમીન અ.સ.એ પણ અલ્લાહના આ ગુણનો પ્રયોગ પોતાની દુઆઓ અને ઝિયારતો વિગેરેમાં કર્યો છે દા.ત. દુઆએ અલ-મુજુરમાં છે, **સુબ્હાનકા યા વકીલો ત્અલયતા યા અદલો અજુરના મિનન્નારે યા મુજુરો...**

**અનુવાદ :** હે મારા પરવરદિગાર ! તમે પાક અને બુલન્દ મોભો ધરાવનાર છો. એ શ્રેષ્ઠ ન્યાય કરનાર (રબ), અમને નર્ક (જહન્મ)ની આગથી આપની પનાહમાં રાખશો.

**આ નામની ખાસીયતો અને ફાયદાઓ :**

(૧) દુઆ શરૂ કરતા પહેલા ૪ વખત “અલ-અદલો”નો વિદ કરવો લાભદાયક અને દુઆ કબુલ થવા માટે અસરકારક છે.

(૨) રાત્રીના સમયે ૧૦૪/ ૧૦૫ વખત “અલ-અદલો”નો વિદ કરવાથી દુઆઓ કબુલ થાય છે.



### બર્ધસ્મેહી સુબ્હાનહૂ તઆલા

વહાલા બાળકો !

અસ્સલામો અલયકુમ !

જમાદીઉલ અવ્વલ માસનો અંક તમારા હાથમાં છે. આ માસમાં ચોથા ઈમામ હઝરત ઝૈનુલ આબેદીન અ.સ.ની અત્યંત પુણ્યશાળી વિલાદત છે. સિલસિલાએ ઈમામતના આ ચોથા હિદાયતના મિનારાની પુણ્યશાળી વિલાદતના પ્રસંગે અમે હૃદયપૂર્વક તમારી સેવામાં મુબારકબાદી અને શુભેચ્છા અર્પણ કરીએ છીએ.

આપના જીવનચરિત્રમાંથી મુશ્કેલી વચ્ચે પણ સત્યને વળગી રહીને કેવી રીતે જીવન વિતાવવું તેનો બોધપાઠ મળે છે. આપે સતત મુસીબતો અને કષ્ટ વચ્ચે એવી રીતે ધીરજ અને ધૈર્યનો નમૂનો રજૂ કર્યો કે જગતમાં તેની જોડ જડે તેમ નથી અને તે રીતે આપે ધૈર્યનું એવું પ્રદર્શન કર્યું જે દરેક વ્યક્તિ માટે પ્રેરણાસ્ત્રોત છે અને મુશ્કેલ પરિસ્થિતીઓ અને દુઃખભર્યા જીવન વચ્ચે પણ પોતાના પાલનહારનો શુક્ર અદા કરતાં રહેવું તે તો સર્વશ્રેષ્ઠ અનુકરણીય નમૂનો છે.

દેખીતી રીતે તો આપે ઈબાદતની મહેરાબમાં બેસીને ફક્ત પોતાના માઅબૂદ સાથે રાઝો-નિયાઝની વાતો અને મુનાજાતોને જ પોતાનો જીવનમંત્ર બનાવ્યો હતો પરંતુ આ એક એવો જિહાદ હતો કે જેનાથી શાસકોના ઈરાદા ડગમગી ગયાં અને તેમણે જે કાવત્રા કરવાનું વિચાર્યું હતું તેના ઉપર પાણી ફરી વળ્યું અને આપે મહેરાબે ઈબાદતમાં બેસીને કરેલ રૂદનના આંસૂઓના પુરમાં અસત્ય (બાતિલ) નષ્ટ થઈ ગયું.

આવી રીતે મહેરાબે - ઈબાદતમાં બેસીને પોતાના માઅબૂદ સાથે આપે રાઝો-નિયાઝની જે વાતો કરી હતી તે વાતોનો “ઝબૂરે-આલે-મુહમ્મદ” સહીફાએ-સજ્જાદિયાહ નામનો સંગ્રહ એક અમુલ્ય ખજાનો છે, જે આપે આપણને આપ્યો છે કે જેની દુઆઓ દુન્યા અને આખરત બંને માટે આપણી એક અગત્યની પુંજી છે.

વહાલા બાળકો ! પરિક્ષાઓનો ગાળો અંતિમ તબક્કામાં છે. આ દુઆઓની સહાયતા વડે જ તમે પોતાની સફળતાને નિશ્ચિત કરી લેજો. વેકેશનનો પણ ભરપૂર લાભ જ્ઞાન ઉપાર્જન માટે લેજો અને પોતાના વિસ્તારના ઉલ્મા હઝરત પાસેથી દીની જાણકારી મેળવીને પોતાના ધાર્મિક જ્ઞાનમાં ઉમેરો કરતાં રહેવા માટે પણ સતત પ્રયત્નશીલ રહેજો !!!

વસ્સલામ

### એરે સરપરસ્તી હમરતે હુજજત

અરવાહોના ફિદાહ, અજજલલ્લાહો તઆલા ફરજહુશરીફ

મર્હુમ જનાબ મૌલાના આબીદ હુસૈન રીઝવી

સાહેબની યાદમાં

ધર્મ પ્રચારક-પ્રખર વિદ્વાન-કૌમના સંનિષ્ઠ સેવક :

આલી જનાબ મુખ્તારઅબ્બાસ વસાયા

મુદ્રિતલેહૂની નિગરાનીમાં

મુખ્ય તંત્રી :

સૈયદ મોહમ્મદ રઝા ગરવી

કાર્યવાહક તંત્રી :

સૈયદ મોહમ્મદ અખ્તર

સહાયકો :

અહમદ રઝા મુરારહ

તાલીમરઝા અજમેરી

એહસાનઅલી રીઝવી

અનુવાદક :

સૈયદ મોહમ્મદ ફાઝિલ બુખારી

આઈ.એ.એસ. (નિવૃત્ત)

શુષોભન :

(Skype Graphics) સાજીદ પંજ

9898013082

E-mail : sajidpanj@yahoo.in

વિગતો માટે સંપર્ક :

યુરોપ, અમેરીકા અને કેનેડા માટે :

અલ્લાહ મુખ્તાર અબ્બાસ સાહબ વસાયા

Mukhtar Abbas Vasaya

91, Longthronton Road, LONDON, SW 16 5QF

Tel. : 0044 - 2082866198 Mo.: 00447828958746

E-mail : movasaya@hotmail.com

વાર્ષિક લવાજમ રૂ. 300/-

ભારત, પાકીસ્તાન, આફ્રીકા, રિયુનીયન માટે :

હૌઝએ ઈલમીયહ ઈમામ ખુમૈની (રહ.)


ગોલ્ડન પાર્ક, વટવા, અમદાવાદ. ગુજરાત. ભારત - ૩૮૨૪૪૦

ફોન : ૦૭૯-૨૫૮૯૨૭૮૬, ૯૪૨૬૬૭૮૬૧૪, ૯૪૨૬૬૭૮૬૧૨, ૯૭૨૪૭૩૭૮૬૫

E-mail : hadimasik@yahoo.com

Website : www.hadikids.org





# કુરઆનની જાણકારી

**પ્રશ્ન :** કુરઆન મજુદના સૂરાઓ અને આયતના “મક્કી” અને “મદની” હોવાનો અર્થ શું થાય છે ?

**જવાબ :** કુરઆન મજુદ આપણાં વહાલા નબી સ.અ.વ. ઉપર નાઝિલ થયું હતું અને આપનું જીવન મક્કા અને મદીના-આ બે શહેરોમાં જ પસાર થયું હતું. તેથી જે સૂરાઓ અથવા આયતો મક્કા શહેરમાં નાઝિલ થઈ હતી તેમને “મક્કી” અને જે મદીના શહેરમાં નાઝિલ થઈ તેમને “મદની” કહેવામાં આવે છે.

**પ્રશ્ન :** “મક્કી” અને “મદની” સૂરાઓ અને આયતોને કેવી રીતે ઓળખી શકાય છે ?

**જવાબ :** એ બાબત નક્કી કરવા માટે કેટલીક નિશાનીઓ અને નિયમો છે. જે ટુંકમાં નીચે મુજબ છે :

“મક્કી” સૂરાઓ અને આયતો	“મદની” સૂરાઓ અને આયતો
સજદાવાળા સૂરાઓ અને આયતો જ્યાં “કલ્લા” શબ્દનો પ્રયોગ થયેલ છે.	જેમાં જિહાદનો હુકમ આવ્યો છે, જેમાં આજ્ઞાઓ (અહકામ) મર્યાદાઓ(હુદુદ) અને ફરજિયાત બાબતો (ફરાઈઝ)નું વર્ણન છે.
જેમાં “યા અય્યોહન્નાસ” અથવા “યા અય્યોહલ્લેઝીના આમનું” એવા શબ્દ સમૂહોનો પ્રયોગ થયો છે.	જેમાં અધિકારો (હુકુક)કાયદાઓ અને સામુહિક અને રાજકારણીય સમસ્યાઓનું વર્ણન છે.
જેમાં અંબિયા અ.સ. અને ભૂતકાળમાં થઈ ગયેલી કોમોના પ્રસંગો વર્ણવવામાં આવ્યા છે.	જેમાં “મુનાફિકો”નું વર્ણન છે. પરંતુ સૂરએ અન્કબૂત સિવાય.
જેમાં આદમ અ.સ. અને “હવ્વા” સલા.ની દાસ્તાનનું વર્ણન છે પરંતુ સૂરએ બકરાહ સિવાય આ સૂરાઓ જે “હુરફે મુક્તીઆત”થી (જેવા કે “અલિફ-લામ-મીમ”, “અલિફ-લામ-મીમ-રા” થી) શરૂ થાય છે. પરંતુ સૂરએ બકરાહ “અને” સૂરએ-આલે ઈમરાન આમાં અપવાદ છે.	જેમાં અહલેકિતાબને વાદ-વિવાદ (યર્યા) કરવાનું કહેવામાં આવ્યું છે.



**પ્રશ્ન :** શું બધાં જ સૂરાઓ અને આયતો મક્કા અને મદીના શહેરોમાં જ નાઝિલ થયા છે ?


**જવાબ :** મોટા ભાગની આયતો અને સૂરાઓ “મક્કા” અને “મદીના” શહેરમાં જ નાઝિલ થયા છે. હા ! પણ કેટલીક (ખુબજ ઓછી સંખ્યામાં) આયતો અને સૂરાઓ એવા છે જે ન તો મક્કામાં નાઝિલ થયાં કે ન તો મદીનામાં, પરંતુ મક્કા અથવા મદીનાની બહાર નાઝિલ થયેલા છે. પરંતુ જે આયતો અથવા સૂરાઓ મક્કાથી નજીકના સ્થળે નાઝિલ થયાં છે તેમની ગણતરી “મક્કી” તરીકે અને જે મદીનાથી નજીકના સ્થળે નાઝિલ થયાં છે તેમની ગણતરી “મદની” તરીકે કરવામાં આવી છે.

**પ્રશ્ન :** શું કુરઆનના સૂરાઓનું વર્ગીકરણ ફક્ત “મક્કી” અને “મદની” તરીકે જ કરવામાં આવ્યું છે ?

**જવાબ :** મોટા ભાગના વિદ્વાનોએ ઉપર જણાવેલ સહેલી પદ્ધતિ જ અપનાવી છે. પરંતુ કેટલાંક વિદ્વાનોએ આયતો અને સૂરાઓનું બીજી રીતે પણ વર્ગીકરણ કરેલ છે. દા. ત. :

હિજરત પહેલાનાં અને હિજરત પછીના : જે આયતો અને સૂરાઓ આપણાં નબી સ.અ.વ.એ મક્કાથી મદીના હિજરત કરી તે પહેલાં નાઝિલ થયેલા છે તેમને “હિજરત પહેલાંના સૂરાઓ અને આયતો” તરીકે અને જે હિજરત પછી નાઝિલ થયેલા છે તેમને “હિજરત પછીના સૂરાઓ અને આયતો” તરીકે ઓળખવામાં અને વર્ગીકૃત કરવામાં આવે છે.

**નોંધ :** વહાલા બાળકો અને પ્રિય નવયુવાનોને આથી વિનંતી કરવામાં આવે છે કે કુરઆનની જાણકારી મેળવવા બાબતે આપના મનમાં કોઈ પ્રશ્ન હોય તો તરત જ અમને જણાવો અથવા લખી મોકલો. આગામી અંકોમાં અમે આપના નામ સાથે આપનો પ્રશ્ન અને તેનો જવાબ પ્રસિધ્ધ કરીશું.





# ઈસ્લામના આલિમો

આયતુલ્લાહ જનાબ ઈબ્રાહીમ અમીની

આપ “જામેઆ મુદર્રસીને હવઝએ ઈલ્મિયએકુમ”ના સભ્ય છે. આપે સામુહિક વિદ્યાઓ અને વાંશિક સંબંધો ઉપર ઘણું જ સંશોધન કર્યું છે અને આ વિષયો સાથે સંબંધિત અમુલ્ય પુસ્તકો પણ લખ્યાં છે.

આપ હિજરી સન ૧૩૦૪ શમ્સીમાં ઈસ્ફહાનના એક શહેર નજફઆબાદમાં જન્મ્યાં હતા અને પોતાનું પ્રારંભિક શિક્ષણ ત્યાંજ મેળવ્યું. સ.૧૩૨૧ હિજરી શમ્સીમાં ધાર્મિક શિક્ષણ મેળવવા માટે હવઝ-એ-ઈલ્મિયાહ અસ્ફહાનમાં પ્રવેશ મેળવ્યો અને અરબી સાહિત્ય-તર્ક શાસ્ત્ર અને વિધાન (ઉસુલ) અને ધર્મશાસ્ત્ર (ફિકહ)નું સંપૂર્ણ શિક્ષણ મેળવ્યું અને સને ૧૩૨૪ હિજરી શમ્સીમાં વધુ વિદ્યાભ્યાસ અર્થે હવઝએ ઈલ્મિયાહ કુમ તરફ પ્રયાણ કર્યું અને ધર્મશાસ્ત્ર (ફિકહ) અને વિધાન (ઉસૂલ) તત્વજ્ઞાન, ભાષાશાસ્ત્ર અને તફસીરનું ઉચ્ચસ્તરીય શિક્ષણ તે યુગના પ્રખ્યાત વિદ્વાનો પાસેથી મેળવ્યું. આપે હવઝએ ઈલ્મિયાહ કુમ અને ઈસ્ફહાનમાં સાહિત્ય-ધર્મશાસ્ત્ર (ફિકહ) અને વિધાન (ઉસુલ)નું શિક્ષણ પણ આપ્યું છે. સાથે સંશોધન અને લેખન કાર્ય પણ શરૂ કર્યાં. ઈસ્લામિક ક્રાંતિની સફળતા પછી આપ “જામેઆ મુદર્રસીને હવઝએ ઈલ્મિયાહ કુમ”ના સભ્ય બન્યાં અને અત્યારે પણ આપ કુમમાં ઈમામે જુમ્હા અને અન્જુમને જામેઅતુલ-ઈમામુસ્સાદિક અ.સ.ના સભ્ય પણ છે.




# જહજુલ બલાગાહ

ડહાપણ ભરી વાતો  
બીમારી અને પાપ (ગુનાહ)

કલમા નં. ૪૨

પોતાના એક સાથીને તેની બીમારીમાં (આપે) ફરમાવ્યું “અલ્લાહે તમારી બીમારીને તમારા પાપ (ગુનાહો) ધોઈ નાંખવાનું કારણ બનાવી છે કેમકે બીમારીનો સ્વયં કોઈ પુણ્ય (સવાબ) નથી. પરંતુ તે પાપને નષ્ટ કરી દે છે અને તેમને (ગુનાહોને) એવી રીતે ઝાટકી દે છે જેવી રીતે વૃક્ષો ઉપરથી પાંદડા ખરી પડે છે. હા ! પુણ્ય તેમાં છે કે કાંઈ મોટેથી બોલવામાં આવે અને કાંઈ હાથ પગ વડે કરવામાં આવે અને ખુદાવંદે આલમ પોતાના બંદાઓમાંથી તેમની શુભ ભાવના અને પવિત્ર ચારિત્ર્ય ને કારણે જેને ઈચ્છે તેને જજ્ઞતમાં પ્રવેશ આપે છે. સૈયદ રઝી ફરમાવે છે કે હઝરત અલી (અ.સ.)એ સાચું કહ્યું છે કે બીમારીનો સ્વયં કોઈ સવાબ નથી. કેમકે બીમારી તો એવા પ્રકારની વસ્તુઓમાંથી છે જેમાં વળતરનો હક હોય છે. એટલા માટે કે અલ્લાહની તરફથી તેના બંદાને દુઃખ-દર્દ-બીમારી જેવા જે કાર્યો (અમ્મ) થાય તેના બદલે તેને આ વળતર મળે છે અને અજ અને સવાબ એ છે કે પોતાના કાર્યોને કારણે તેને મળે છે. આમ વળતર જુદી વસ્તુ છે અને અજ અને સવાબ તદ્દન જુદી જ વસ્તુ છે. આ તફાવતને અમીરૂલ મોઅમેનીન અ.સ. એ પોતાના પ્રકાશિત જ્ઞાન અને પોતાના ચિંતન અને બુદ્ધિ અનુસાર (લોકોને આ વાત સરળ રીતે સમજાઈ જાય તે રીતે) વર્ણવેલ છે.”





# જ્ઞાનની ખોજ

ઘણાં વરસો પહેલાંની વાત છે. ત્યારે હિન્દુસ્તાન ઉપર એક સમ્રાટનું શાસન હતું. એક દિવસ તેના દરબારમાં કોઈ બીજા દેશનો વેપારી આવ્યો. તે યુગમાં એવો રિવાજ હતો કે જ્યારે કોઈ બીજા દેશનો વેપારી વેપાર અર્થે અન્ય દેશમાં જતો તો તેણે સૌથી પ્રથમ સમ્રાટની સેવામાં ભેટ-સોગાત ધરવી પડતી હતી અને વેપારની મંજૂરી લેવી પડતી હતી, જેથી તે નિર્વિઘ્ન રીતે પોતાનો વેપાર કરી શકે. તેથી તે વિદેશી વેપારી પણ તે પ્રણાલી પ્રમાણે સમ્રાટની સેવામાં કેટલીક ભેટ-સોગાદો અર્પણ કરીને તેની વિશિષ્ટતાનું વર્ણન કરવા લાગ્યો.

વાહ ! સમ્રાટે કહ્યું : “આ બધી વસ્તુઓ ઘણી ઉચ્ચ કોટીની અને બહુમુલ્ય છે. જે તમે જુદા જુદા દેશોમાંથી ખરીદી છે. પરંતુ શું તમને હિન્દુસ્તાનમાં એવી કોઈ વસ્તુ દેખાઈ નહીં જે અમારા દરબારને અનુરૂપ હોય.”


વેપારીએ સમ્રાટને પ્રભાવિત કરવા કહ્યું : “હે મહાન સમ્રાટ ! આપના દરબારને અનુરૂપ તો મને ઘણી વસ્તુઓ લાગી હતી પરંતુ એક વસ્તુ એવી છે કે આપના દરબારને સંપૂર્ણપણે અનુરૂપ છે.”

વાહ ! તો એ કઈ વસ્તુ છે ? સમ્રાટે પુછ્યું.

હજુર ! તે એક વૃક્ષ છે. વેપારીએ કહ્યું : જે સર્વત્ર થાય છે. પરંતુ તેને મેળવવા માટે ઘણી મહેનત કરવી પડે છે.

સમ્રાટે આશ્ચર્યચકિત થઈને પુછ્યું : “શું તેમાં કોઈ વિશિષ્ટતા છે ?”

વેપારીએ કહ્યું : “હા, મહાન સમ્રાટ ! તે એવા સુંદર ફળવાળું વૃક્ષ છે કે જે કોઈ એનું ફળ ખાય છે તે ન તો કદી વૃદ્ધ થાય





છે કે ન તો મૃત્યુ પામે છે. આ વૃક્ષમાં તો અમૃતના ગુણ હોય છે.”

વેપારી પાસેથી આ આશ્ચર્યજનક વૃક્ષ વિશે સાંભળીને સમ્રાટ તો આશ્ચર્યચકિત રહી ગયો અને તે વૃક્ષને જોવા માટે વ્યાકુળ થઈ ગયો. તેણે પોતાના મંત્રીને બોલાવ્યો અને એવી આજ્ઞા આપી કે :

“મને એવી જાણકારી મળી છે કે જગતમાં અને આપણાં હિન્દુસ્તાનમાં પણ એક એવું વૃક્ષ છે કે જેનું ફળ કોઈ ખાઈ લે તો તે કદી ઘરડો નથી થતો અને તે મૃત્યુ પણ પામતો નથી. તમે જાવ અને એ વૃક્ષ શોધી કાઢો. તેમાં કેટલોય સમય કેમ ન લાગે તેની પરવા નથી પરંતુ જો જો હોં ! નિષ્ફળ થઈને પરત ન આવતા.”

સમ્રાટની આજ્ઞા પ્રમાણે તે મંત્રી પેલા વૃક્ષની શોધમાં નીકળી પડ્યો. તે જંગલો, પર્વતો, મેદાનો તમામ સ્થળોએ ફરી વળ્યો પરંતુ તેને એવા વૃક્ષનો કોઈ પત્તો લાગ્યો નહીં. તે જેને પણ એવા વૃક્ષ વિશે પ્રશ્ન કરતો તે વ્યક્તિ તેની હાંસી ઉડાડતા હતા. કોઈ કહેતું, તારૂં મગજ તો ઠેકાણે છે ને ? આપું વૃક્ષ તો હોય જ નહીં. કોઈ કહેતું, હે મુસાફર ! જેનું કોઈ અસ્તિત્વ જ ન હોય તેવા વૃક્ષની શોધખોળ જ વ્યર્થ છે. મંત્રી લોકોની વાતો સાંભળતો પરંતુ ધીરજ રાખવા સિવાય તેની પાસે બીજો કોઈ ઉપાય જ નહોતો. પરંતુ તે હતો પોતાના નિશ્ચયમાં અડગ ને જુદા જુદા દેશ પ્રદેશમાં ફરીને તે વૃક્ષને શોધતો જ રહ્યો પરંતુ તેને તે વૃક્ષનો કોઈ અણસાર સરખોયે મળ્યો નહીં. છેવટે નિરાશ થઈ પોતાના વતન તરફ પાછો ફર્યો. પરંતુ તેને નિષ્ફળતાના અપમાન અને સમ્રાટ તરફથી શિક્ષા થવાનો ભય પણ હતો.

પાછા ફરતી વખતે એક સ્થળે તેને એક વ્યક્તિ મળી. તેણે મંત્રીને પુછ્યું “હે મુસાફર ! તું આટલો દુઃખી કેમ છે કે તારી આંખમાંથી અશ્રુઓ વહી રહ્યાં છે. મંત્રીએ નિસાસો નાંખીને પોતાની આપવીતી કહી સંભળાવી.





તે વ્યક્તિએ મંત્રી પ્રત્યે સહાનુભૂતિ દાખવીને કહ્યું “હે મુસાફર ! તું દુઃખી ન થા. અહીંયા નજીકમાં જ એક સંત રહે છે, તે ખુબ જ મહાન વિદ્વાન છે, તે તારી ચિંતા જરૂર દૂર કરશે.”


મંત્રીએ તે વ્યક્તિનો આભાર માન્યો, તે પેલા સંતને મળવા નીકળી પડ્યો અને ઘણી આશા સાથે તે સંતની સેવામાં હાજર થયો કે કદાચ આ સંત મારી નિરાશા દૂર કરે અને મારી પેલા વૃક્ષની શોધખોળનો પણ અંત આવે.

તે પેલા સંત સમક્ષ ગયો તો સંતે તેને ખૂબ જ સહાનુભૂતિભર્યા અવાજમાં કહ્યું : હે મુસાફર ! તું કેમ રડે છે ? અને આટલો નિરાશ કેમ દેખાય છે ?

મંત્રીએ કહ્યું : “હે મહાત્મા ! હું દરેક સ્થળેથી નિરાશ થઈને આપની સેવામાં હાજર થયો છું. મને આપની સહાયતાની જરૂર છે. આપ મારી ચિંતાનું નિવારણ કરી આપો તેવી મારી વિનંતી છે. આમ કહીને તેણે પોતાની આપવીતી કહી સંભળાવી. મંત્રીની વાત સાંભળીને તે સંત ખડખડાટ હસી પડ્યાં અને કહ્યું : અફસોસ, કે તે બુદ્ધિ વાપરી નહીં અને ફક્ત એક વૃક્ષની શોધમાં આટલા વરસો સુધી ભટકતો રહ્યો.”

મંત્રીએ પુછ્યું : “હે મહાત્મા ! આપ શું કહો છો ? ”

સંતે જવાબ આપ્યો : “ભલા માણસ ! તે વૃક્ષ ખરેખર તો વિદ્યા અને જ્ઞાનનું વૃક્ષ છે, પરંતુ તું તો પ્રત્યક્ષ વૃક્ષને શોધતો રહ્યો. જ્ઞાન એક એવો સમુદ્ર છે જે કદી ખુટતો નથી, એક એવું વૃક્ષ છે જેના ઉપર આખા વરસ સુધી ફળ આવે છે. એક એવો સૂર્ય છે જે કદી આથમતો નથી, એક એવો ચંદ્રમાં છે જે પોતાના ટાટકભર્યા પ્રકાશથી જગતને





પ્રકાશમય કરે છે.”

મંત્રીએ આશ્ચર્યચકિત થઈને પુછ્યું : “પરંતુ હે મહાત્મા ! કદી વૃદ્ધ ન થવાની અને કદી મૃત્યુ ન પામવાની વાત ?”

તે મહાત્માએ સ્મિત વેરતાં કહ્યું : “જ્ઞાનના વૃક્ષને હંમેશા પોતાની મહેનત વડે સિંચતા રહો અને તેના ફળ હમેંશા ખાતા રહો. જે વ્યક્તિ આ રીતે આચરણ કરતો રહેશે તેનું જ્ઞાન કદી વૃદ્ધ નહીં થાય અને તે ક્યારેય નાશ પણ પામશે નહીં. હે મુરખ! વૃક્ષને કેમ શોધે છે ? તેની વિશિષ્ટતાઓ શું છે તેનો વિચાર કર ! કોઈપણ વસ્તુની વિશિષ્ટતાઓનો સંબંધ તેના નામમાં હોતો નથી, તેના આંતરિક ગુણમાં હોય છે. ખુદાએ ઉત્પન્ન કરેલ આ માનવજાતમાં જે મતભેદો સર્જાય છે તે પણ ફક્ત નામને કારણે સર્જાય છે. પરંતુ જ્યારે સત્ય બહાર આવે છે ત્યારે બધા મતભેદો આપોઆપ દૂર થઈ જાય છે.”

તે સંતની વાત સાંભળીને મંત્રીને સંતોષ થઈ ગયો કે ખરેખર જ્ઞાનનું વૃક્ષ જ એક એવું વૃક્ષ છે જેના ફળ ખાનાર વ્યક્તિ ન તો કદી ઘરડો થાય છે કે તે કદી મરતો પણ નથી. તેણે પેલા સંતનો આભાર માન્યો અને કહ્યું : “હે મહાત્મા ! આપે તો મારી વરસોની મહેનતને ઉપયોગી બનાવી દીધી.”

તે પછી તે મંત્રી પ્રસન્નતાપૂર્વક પોતાના માદરે વતન તરફ પાછો ફર્યો અને ત્યાં જઈ ને સમ્રાટને જ્ઞાનના વૃક્ષ વિશે સંપૂર્ણ સમજણ આપી ત્યારે સમ્રાટ પણ મંત્રીની વાત સાથે સંમત થઈ ગયો.







# ખુલફા ઉલ્લાહ

(અલ્લાહના પ્રતિનિધિઓ)

કુમૈલ-બિન-ઝિયાદ એ વર્ણન કર્યું છે કે એક દિવસ અમીરૂલ મોઅમેનીન અ.સ. મારો હાથ પકડીને એક વેરાન સ્થળે લઈ ગયા અને ત્યાં જઈને એક આહ ભરીને ફરમાવ્યું : “નિઃશંકપણે આ પૃથ્વી ખુદાની દલીલ (હુજ્જત)ને કાયમ રાખવાવાળાથી ખાલી નથી રહી શકતી. ચાહે તે પ્રગટ હોય કે અપ્રગટ (ગાયબતના પડદામાં) હોય જેથી કરીને અલ્લાહની દલીલો જુઠલાવી શકાય નહીં. પરંતુ આ કેટલાં છે અને ક્યાં છે ? ખુદાના સમ ! સંખ્યાની દૃષ્ટિએ તેઓ ખુબ જ ઓછા છે. પરંતુ તેમના સ્થાન અને મહત્વની દૃષ્ટિએ તેઓ ઘણાં મહાન છે. એમની મારફતે જ પરવરદિગાર પોતાની દલીલોનું રક્ષણ કરે છે. એટલે સુધી કે તેઓ (આ જવાબદારી) પોતાના જેવાઓ (પોતાના ઉત્તરાધિકારીઓ)ને સોંપી દે અને પોતાના જેવા લોકોના મનમાં આ બાબત સાબિત કરી આપે. તેમને (તેમના) જ્ઞાને દિવ્યદૃષ્ટિની હકીકત સુધી પહોંચાડી દીધાં છે. (એટલે કે તેમને દિવ્ય દૃષ્ટિ

પ્રાપ્ત થયેલી છે) અને ચકીનની આત્મા (રહે ચકીન) તેમનામાં રચી પચી ગઈ છે. જે (વસ્તુ - બાબત)ને દુન્યવી લોકો સખત સમજે છે તે તેમના માટે નરમ છે

અને અજ્ઞાની લોકોને જેનાથી ગભરામણ થાય છે તેનાથી તેમને પ્રેમ હોય છે તેઓ આ જગતમાં એવા શરીરો સાથે જુવે છે, જેમની આત્મા અલૌકિક જગત (આલમે આઅલા) સાથે સંકળાયેલી રહે છે. તેઓ પૃથ્વી



ઉપર ખુલફાઉલ્લાહ (અલ્લાહના પ્રતિનિધિઓ) અને તેના દીન તરફ બોલાવવાવાળા (આમંત્રણ આપવાવાળા) છે. હાય ! મને એમને જોવાની કેટલી ઉત્કંઠા છે. (નહજુલ બલાગાહ - હિકમત - ૧૪૭) ખિસાલ - પા. ૧૮૬ - ૨૫૭ કમાલુદ્દીન પા. ૨૯૧ ॥ તારીખે યાઅફૂબી ભા. ૨ પા. ૨૦૬ ॥ ખસાઈ ચુલ અઈમ્મા ॥ પા. ૧૦૬ ॥ હુલ્લુતુલ અવલિયા - ભા. ૧ પા. ૭૯ ॥ કનઝુલ અમ્માલ ભા-૧૦ - પા. ૨૬૨- ૨૯૧ ॥ ઈમાલી યુશ્શહાજરી - ભા. ૧ પા. ૬૬ ॥ ” મનાકિબે અમીરુલ મોઅમેનીન (અ.સ.) અલફૂફી-હદીસ પા. ૯૫)

અલી બિન હિસાન એ ઈમામ રિઝા અ.સ.ને ઈમામ મુસિયે કાઝિમ અ.સ.ની ઝિયારત વિષે પુછ્યું ત્યારે આપ સ.અ.વ.એ ફરમાવ્યું : “કબરની ચારેકોર જે મસ્જિદમાં ઈચ્છા હોય ત્યાં નમાઝ અદા કરો અને ઝિયારત માટે દરેક સ્થળે એટલું (કહેવું) પુરતું છે કે “સલામ હોય પરવરદિગારના અવલિયા અને અસફિયા ઉપર - સલામ હોય અલ્લાહના અમન્તાઅ અને અહિબ્બા ઉપર - સલામ હોય અલ્લાહના અન્સાર અને ખુલફાઅ ઉપર (અલફૂફી - ભા. ૨ - પા. ૬૦૮ ॥ ઉચુને અખ્બાર રિઝા (અ.સ. ભા. ૨ પા. ૨૭૧ ॥ કામિલુઝઝિયારાત પા. ૩૧૫ - કાફી ભા. ૪ - પા. ૫૭૯)”

ઈમામ અલી નકી અ.સ. એ ઝિયારતે જામેઆમાં ઈશાદિ ફરમાવ્યું છે : “હું સાક્ષી છું કે આપ લોકો “અઈમ્મએ રાશેદીન - ૫ મેહદીયીન” છો. ખુદાએ પોતાની આત્માથી આપ લોકોનો સ્વીકાર કર્યો છે અને આપ લોકોને પૃથ્વી ઉપર પોતાના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા છે. (તેહઝીબ ભા- ૬, પા. ૯૭ હદીસ ૧૭૭)





# હસો અને હસાવો દુયકાઓ



શિક્ષક - બાળકોને : સંકટના સમયે દરેકની સહાયતા કરવી જોઈએ.

એક શિષ્યે (ઉભા થઈને) સર : ગઈકાલે મેં એક વૃદ્ધ વ્યક્તિની સહાયતા કરી હતી.

શિક્ષક : કેવી રીતે ?

શિષ્ય : સર ! તે વૃદ્ધ વ્યક્તિ સડક પાર નહોતો કરી શકતો, મેં તેની પાછળ એક કુતરો દોડાવી દીધો તેથી તેણે ઝડપથી સડક પાર કરી લીધી હતી.

એક ગાયકે પોતાના પાડોશીને કહ્યું : “ભાઈ સાહેબ ! જ્યારે પણ હું ગાયન ગાવાની પ્રેક્ટીસ કરું છું ત્યારે આપનો કુતરો ભસવા લાગે છે.”

પાડોશીએ જવાબ આપ્યો : એમાં કુતરાનો શો દોષ છે, શરૂઆત તો આપ જ કરો છો ને !



સોનુએ મોનુને કહ્યું : “મિત્ર ! તમારા દાદીમાં હમેશાં રામાયણ અને મહાભારત કેમ વાંચતા હોય છે ?

મોનુએ કહ્યું : “મારા દાદીમાં પોતાની છેલ્લી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે.”

એક ગામડિયો પોતાના ગઘેડાના ચારે પગ બાંધી રહ્યો હતો. ત્યાં પસાર થતાં એક પોલીસવાળાએ જોઈને કહ્યું : “તમે પોતાના ભાઈના જ ચારે પગ કેમ બાંધી રહ્યા છો ?

એ સાંભળીને ગામડિયાએ હસીને કહ્યું : “એટલા માટે કે આ ગઘેડો પણ ક્યાંક પોલિસમાં ભરતી ન થઈ જાય.”





## આંખ

### સતત પલકારા કેમ માર્યા કરે છે ?

કુદરતે આંખનાં પોપચાને અનેક કામ સોંપ્યા છે. પહેલું કામ લેન્સ જેવા ડોળાને ચોખ્ખા રાખવાનું છે. કેમેરામાં સ્પષ્ટ દ્રશ્ય ઝીલવા માટે જેમ કાચના લેન્સને સ્વચ્છ રાખવો પડે છે તેમ આંખનો કુદરતી લેન્સ પણ હંમેશા ચોખ્ખો રહેવો જોઈએ. આથી પોપચાનો દરેક પલકારો ડોળા પર બાઝતા રજકણો જેવા કચરાને સાફ કરે છે. બીજું એ કે જો ડોળા ભીનાં ન રહે તો હવાના ઓક્સિજનને શોષી શકે નહિ. શરીરના બધા અવયવોમાં માત્ર આંખનાં ડોળાને લોહી દ્વારા ઓક્સિજન મળતો નથી. એટલે તે પુરવઠો બારોબાર હવા દ્વારા મેળવવો પડે છે. ઈજા થવાનું કે ઝાપટ વાગવાનું જોખમ હોય ત્યારે ઘડીના છઠ્ઠા ભાગમાં બીડાઈ જતા પોપચા આંખોને રક્ષણ આપે છે. આવા કાર્યો માટે કુદરતે પોપચાંને આપોઆપ પલકારા માર્યા કરે એવાં બનાવ્યા છે. માણસની આંખનાં પોપચાં સરેરાશ પાંચ સેકન્ડે ૧ પલકારો કરે છે.



# ઉંદરે જાળ કોતરી ખાધી

એક જંગલમાં એક સિંહ રહેતો હતો. ઉનાળાના દિવસો હતા. આકરો તાપ હતો. સિંહ ગરમીથી અકળાઈ ગયો હતો. તે ઝાડના છાંયે બેસી ઊંઘતો હતો. એવામાં એક ઉંદર ત્યાં આવી ચડ્યો. સિંહને ઊંઘતો જોઈ તેના શરીર પર દોડાદોડી કરવા લાગ્યો. તેના શરીર પર તે રમવા લાગ્યો. કેશવાળી પકડી મૂલા ખાતો હતો. ત્યાં તેની પૂંછડી સિંહના નાકમાં ભરાઈ તેથી સિંહની ઊંઘ ઊડી ગઈ. તેણે ‘હાક... છી !’ કરી છીંક ખાતાં ખાતાં એક ઉંદરને ભાગતો જોયો. તેણે નાસતા ઉંદરની પૂંછડી પોતાના પંજાથી દબાવી દીધી.

ઉંદર ડરી ગયો, કરગરીને બોલ્યો : ‘સિંહદાદા, આપ જંગલના રાજા છો. એક ગુનો માફ કરી મને છોડી દો, જરૂર પડશે ત્યારે હું તેનો બદલો વાળી આપીશ !’ સિંહ એ સાંભળી હસી પડ્યો અને બોલ્યો : ‘ ઉંદરડા ! નાનકડા જીવડા, તું મને શી મદદ કરવાનો ?’ ઉંદરે હાથ જોડી ફરી વિનંતી કરી, ‘સિંહદાદા, એક વખત મને જીવતદાન આપો, તમારો ઉપકાર જિંદગીભર યાદ રાખીશ.’ આટલું બોલતાં ઉંદરની આંખમાં આંસુ આવી ગયાં.

નાનકડા ઉંદરને રડતો જોઈ સિંહને તેની દયા આવી. તેણે ઉંદરને જવા દીધો. થોડાક દિવસો પછી સિંહને પકડવા શિકારીઓ જંગલમાં ઘૂસી ગયા. તેણે સિંહને પકડવા જાળ પાથરી. જાળને સૂકા પાંદડાંથી ઢાંકી દીધી. સિંહ ત્યાંથી ચાલવા ગયો. તે શિકારીઓએ પાથરેલી જાળમાં ફસાઈ ગયો.





શિકારીઓએ તેને જાળમાં બરાબરનો બાંધીને  
ઝાડની ડાળીએ લટકાવી દીધો. પછી તેઓ તે  
સિંહને લઈ જવા મોટું પાંજરું લેવા ગયા. સિંહે  
જાળમાંથી છૂટવા ઘણાં ફાંફા માર્યા પણ  
ફોગટ ! થાકીને સિંહે ગર્જના કરવા માંડી.

નાનકડા ઉંદરે સિંહની ગર્જનાઓ  
સાંભળી. તે અવાજ ઓળખી ગયો. તરત જ  
સિંહ પાસે દોડી આવ્યો. ઝાડ ઉપર તેણે  
સિંહદાદાને બંધાયેલો જોયો.

ઉંદર બોલ્યો : ‘સિંહદાદા, ધીરજ  
રાખજો. શિકારીઓ તમને લેવા આવે તે પહેલાં  
જ હું જાળ કાપી નાખીશ ને તમને બંધનમાંથી  
છોડાવી દઈશ !’ એમ કહી ઉંદર ઝાડ ઉપર  
સડસડાટ ચડી ગયો. પોતાનાં તીણા દાંતથી

જાળ કાપવા માંડી. કટ... કટ... કટ... જોતજોતામાં તેણે દાંત વડે જાળ કોતરી  
નાખી. જાળ કપાતાં સિંહ ભફાંગ અવાજ સાથે જમીન પર પડ્યો. છુટકારાનો દમ  
લેતાં બોલ્યો : મિત્ર, તારો ખૂબ આભાર. “મોટાઈમાં ફુલાઈને નાનો જાણી તારી  
ખોટી અવગણના કરી તેનો મને પસ્તાવો થાય છે.”

સિંહની વાત સાંભળી ઉંદરને સંતોષ થયો કે, ‘પોતાના પર કરેલા  
ઉપકારનો બદલો તે વાળી શક્યો.’







# વિશ્વની જાણકારી મીઠાનો પ્રદેશ

દક્ષિણ અમેરિકાના રાજ્ય બોલોવિયામાં સારાર-ડી-યૂની (Salar-de-uyane)માં એવો પ્રદેશ છે જ્યાં પૃથ્વી ઉપર માટીની જગ્યાએ મીઠાના પડ જામેલા છે. આ મીઠાવાળો પ્રદેશ લગભગ ૧૨ ચો.કી.મી. માં ફેલાયેલો છે અને એક અંદાજ પ્રમાણે ત્યાં ૧૦ અરબ ટન મીઠાનો જથ્થો છે. આ પ્રદેશ સમુદ્રની સપાટીથી આશરે ૧૧૯૭૫ ફૂટની ઉંચાઈએ આવેલો છે. જગતનો આ સૌથી વિશાળ મીઠાનો પ્રદેશ ઇન્ડીઝ પાસે બોલોવિયાથી નૈઋત્ય દિશામાં પોટોસીની પાસે છે. આ પ્રદેશમાં અન્ય મહત્વની ખનીજો જિપ્સમ અને હાલાઈટ પણ મળી આવે છે.





કહેવાય છે કે આશરે ૪૦ હજાર વરસ પહેલાં આ પ્રદેશ મેશન નામના એક મોટા સરોવરનો ભાગ હતો. જ્યારે આ સરોવર સુકાઈ ગયું ત્યારે તેમાંથી પોલો અને વાવરૂ નામના બે નવા સરોવર બની ગયા અને મીઠાના બે મોટા રણ પ્રદેશો સાલાર - ડી - કોઈપાસા અને સાલાર-ડી-યુની પણ આ સરોવર સુકાઈ જવાને કારણે જ બન્યા છે. અહીંયા જે ૧૦ અરબ ટન મીઠાનો જથ્થો છે, અને તેમાંથી દર વરસે આશરે ૨૫ હજાર ટન મીઠાનું ઉત્પન્ન થાય છે. અહીંયા કામ કરવાવાળા મજૂરો સુર્યોદયથી સુર્યાસ્ત સુધી સતત મજૂરી કરે છે અને બપોરે લંચ બ્રેકમાં કોકાના પાંદડા ચાવીને શક્તિ મેળવે છે.

મીઠાના આ રણ પ્રદેશમાં પ્રવાસીઓ અને સહેલાણીઓના મોજશોખ માટે પણ ઘણાં આકર્ષણો છે. જેમાં મીઠાથી બનાવવામાં આવેલ એક હોટલ પણ છે. આ હોટલની દિવાલો છત- દરેક વસ્તુ એટલે સુધી કે ખુરશી - ટેબલો પણ મીઠાના જ બનાવેલા છે. પરંતુ અહીંયા આવનાર સહેલાણીઓને આ હોટલની દિવાલો - ખુરશી ટેબલ વિગેરેને પોતાની જીભ વડે ચાટવાની મનાઈ ફરમાવવામાં આવેલ છે.



# ઈમામ સજ્જાદ અ.સ. અને સદાચાર તેમજ નિપૂણતાઓ

પયગમ્બરે ખુદાના મુબારક વંશજોની એ વિશિષ્ટતા હતી કે બાર વ્યક્તિઓ સતત એક જ પ્રકારની માનવીય નિપુણતાઓ અને સર્વશ્રેષ્ઠ સદાચાર અને સદગુણો ધરાવતાં રહ્યા. જેમાંનો દરેક પોતાના સમકાલિન યુગમાં માનવજાતિ માટે સર્વશ્રેષ્ઠ આદર્શ અને પ્રેરણાનો સ્ત્રોત રહ્યાં હતાં.

આમ આ શુંખલાની ચોથી કડી સૈયદ સજ્જાદ અ.સ. હતા જે સદાચાર અને સદગુણોમાં પોતાના વડવાઓના નમૂનારૂપ હતા. જે તેમનામાં એક બાજુએ ધૈર્ય અને સહનશક્તિનો એ ખજાનો હતો જે કરબલામાં આપનામાં દંષ્ટિગોચર થયો હતો તો બીજી બાજુએ નમ્રતા અને ક્ષમા આપવાની વૃત્તિના ગુણ પણ આપનામાં અત્યંત ઉત્કૃષ્ટ પ્રમાણમાં હતા. આપે એવા પ્રસંગોએ કે જ્યારે પોતાના સાથે અભદ્ર રીતે વાત કરનાર વ્યક્તિ સાથે પણ જે રીતે વ્યવહાર કર્યો છે તેના ઉપરથી એવું ક્યારેય લાગતું નથી કે એક મજબૂર અને લાચાર વ્યક્તિ ડરીને અને પોતાને અસહાય સમજીને નમ્રતાપૂર્વક વર્તતો હોય,. પરંતુ તેવા પ્રસંગોએ આપના વ્યવહારમાંથી સ્પષ્ટ રીતે એ હકીકત જાહેર થાય છે કે આપ ક્ષમાવૃત્તિ અને સહનશીલતાની મહાનતા પ્રદર્શિત કરીને પોતાના ચારિત્ર્ય વડે તેનું દૃષ્ટાંત પુરૂ પાડતાં હતાં.

એક વ્યક્તિએ આપની સાથે ખુબ જ અભદ્ર ભાષામાં વાત કરી. હઝરત અ.સ. એ ફરમાવ્યું “તે જે કાંઈ કહ્યું છે તે સાચું હોય તો ખુદા મને માફ કરે અને ખોટું હોય તો ખુદા તને માફ કરે.”

આ ઉચ્ચ ચારિત્ર્યના પ્રદર્શનની તેના ઉપર એવી અસર થઈ કે તેણે માથું નમાવીને કહ્યું “સાચું તો એ છે કે મેં જે કાંઈ કહ્યું છે તે જ ખોટું હતું.”

આવા જ એક અન્ય પ્રસંગે એક વ્યક્તિએ આપ અ.સ. ના માટે અશિષ્ટ શબ્દોનો પ્રયોગ કર્યો. આપ અ.સ. એ તેના પ્રત્યે કાંઈ ધ્યાન જ આપ્યું નહીં. જાણે કાંઈ



સાંભળ્યું જ ન હોય. પેલી વ્યક્તિએ મોટેથી કહ્યું “હું આપને જ આ સંભળાવી રહ્યો છું.” આપે કહ્યું “હું કુરઆનની આજ્ઞાનું પાલન કરી રહ્યો છું.” આપની આ વાત કુરઆનની એક આયત તરફ અંગૂળિ નિર્દેષ કરે છે કે “ખુઝિલ અફવા-વ - અમુરબિલ માઅરફ - વ - આઅરિઝ અનિલ જાહેલીન” એટલે ક્ષમાવૃત્તિ અપનાવો. સારા કામો - કાર્યોની શિખામણ આપો અને અજ્ઞાની લોકો પ્રત્યે ધ્યાન જ ન આપો.



હશશામ-બિન-ઈસ્માઈલ નામની વ્યક્તિએ હઝરત અ.સ. વિશે કેટલીક અશોભનીય ટિપ્પણીઓ કરી હતી. આ સમાચાર બની ઉમય્યાના એક નેક સમ્રાટ ઉમર-બિન-અબ્દુલ અઝીઝ સુધી પહોંચ્યા. તેણે આપ અ.સ.ને લખીને જાણ કરી કે “હું તેને શિક્ષા કરીશ” આપે કહેડાવ્યું “હું નથી ઈચ્છતો કે મારા કારણે તેને કોઈ નુકશાન થાય.”

આપની દાનવીરતા અને માનવસેવાની વૃત્તિ એવી હતી કે રાત્રે આપ અનાજ અને રોટલીઓ પોતાની પીઠ ઉપર ઉપાડીને ગરીબોને ઘરે લઈ જતા હતા અને ચુપકીદીથી આપી આવતા હતા. ઘણાં લોકોને ખબર જ નહોતી પડતી કે આ ક્યાંથી આવે છે અને આ તેમને પહોંચાડનાર કોણ છે ? જ્યારે હઝરતની શહાદત થઈ ત્યારે તેમને ખબર પડી કે આ તો ઈમામ ઝૈનુલ આબેદીન અ.સ. હતા. સહાયતા કરી તેને ગુપ્ત રાખવાના આ ગુણ ઉપરાંત આપના ઈલ્મની પરાકાષ્ટા પણ એ દરજ્જા ઉપર હતી કે શત્રુઓ પણ આપની વિદ્વતા સામે માથું નમાવતા હતા અને સ્વીકારતા હતા કે આપના સમકાલિન વિદ્વાનોમાં ધર્મશાસ્ત્ર (ફિકહ) અને ઈલ્મે દીનમાં કોઈ આપનો સમોવડિયો નહોતો. ચારિત્ર્યની આ સઘળી ઉચ્ચતાઓ સાથે આપ જગતને એવો બોધ પણ આપતાં હતાં કે કોઈએ પોતાના ઉચ્ચ કુળના હોવાની બાબતે ગર્વ કરવો જોઈએ નહીં.





# આપ્તામોલ મોતી

ઈબાદત : હે મારા ઈમાન લાવનારા (મોમિન) બંદાઓ ! નિઃસંશય મારી ભૂમિ અતિ વિશાળ છે. તેથી તમે ફક્ત મારી જ ઈબાદત કરો. દરેક જીવ મૃત્યુનો સ્વાદ ચાખનાર છે. પછી તમો સર્વેને અમારી તરફ જ પાછા ફેરવવામાં આવશો. (સૂરએ-અન્કબૂત-૨૯-આયત ૫૬-૫૭)

કૃત્યોનો સ્વાદ : તેઓ તમારી પાસેથી અઝાબના સંબંધમાં ઉતારવા કરે છે. જો કે જહન્નમે કાફરો (ઈન્કાર કરવાવાળાઓ)ને ઘેરી લીધા છે. તે દિવસે કે જ્યારે અમારો અઝાબ તેમને ઉપરથી અને પગ તળેથી પણ ઘેરી લેશે અને (અલ્લાહ તેમને) ફરમાવશે કે તમો જે જે કૃત્યો કરતાં હતાં તેની હવે મજા ચાખો. (સૂરએ અન્કબૂત-૨૯-આયત-૫૪-૫૫)

અઝાબ :- અને આ લોકો તમારી પાસે (અલ્લાહ તરફથી) અઝાબ (ઉતારવાના) સંબંધમાં ઉતારવા કરે છે. પણ જો (અઝાબ ઉતારવાનો) સમય નક્કી કરેલો ન હોત તો તેમના ઉપર તે અઝાબ ક્યારનોય આવી ચુક્યો હોત અને ચોક્કસ તે (અઝાબ) તેમને ઓચિંતો એવી રીતે આવી પકડશે કે તેમને જાણ થશે નહીં (સૂરએ-અન્કબૂત-૨૯-આયત ૫૩)

રહેમત અને નસીહત :- શું તેમના માટે આ પુરતું નથી કે અમે આપની ઉપર કિતાબ ઉતારી જે તેમને સંભળાવવામાં આવે છે. નિઃસંશય જે લોકો ઈમાન લાવ્યા છે તેમના માટે આ (કિતાબ)માં ચોક્કસ રહેમત અને નસીહત છે. (સૂરએ-અન્કબૂત-૨૯ - આયત ૫૧)



# નબી સ.અ.વ.ની વહાલી વાતો

(ગતાંકથી ચાલુ)

૧૮ : જો ખુદાવન્દે આલમ પોતાના કોઈ બંદાને ભલાઈ અને નેકીની પ્રેરણા આપવા ઈચ્છે છે તો તેના અંતઃકરણને તેને માટે બોધ આપનાર અને માર્ગદર્શક બનાવી દે છે.

૧૯ : પોતાનાથી કોઈને કોઈ ખતા (ભૂલ, ગુનો) થઈ ગયો છે તેવી તેણે શંકા પણ ન કરી હોય તેવો કોઈપણ દિવસ કોઈપણ મોમિન પસાર કરતો નથી.

૨૦ : મનુષ્યનો સૌથી ખરાબ શત્રુ તેને ભૂંડા કાર્યોની દિશામાં દોરી જનાર તેનું મન છે જે તેના બે પડખાઓ વચ્ચે છે.

૨૧ : લોકો ! સૌથી મહાન શક્તિશાળી એજ છે કે જેણે પોતાના મનને પોતાના કાબૂમાં કરી લીધું હોય.

૨૨ : પોતાના મનની બુરાઈઓથી લડાઈ કરો જેથી કરીને તમે તેના માલિક બની જાવ.

૨૩ : મુબારકબાદ છે એ વ્યક્તિને કે જે પોતાની બુરાઈઓ (ખામીઓ)ની કાળજી લેવાને કારણે બીજાઓની બુરાઈઓને જોવાથી બચીને રહેતો હોય.

૨૪ : સત્યપ્રિયતા મનુષ્યના મનને આરામ અને શાંતિ આપે છે. જ્યારે અસત્યવાદ અને શંકા-કુશંકાઓ તેની ચિંતાઓ વધારી મૂકે છે.



# જીવનનો અધિકાર

કુદરતી રીતે જીવવાનો અધિકાર અન્ય બધા અધિકારો કરતા વધારે મહત્વનો છે. અલ્લાહતઆલા ઈશાદિ ફરમાવે છે કે “વલા તકતોલૂ અન્ફોસકુમ-ઈન્નલ્લાહા કાના બેકુમ રહીમા-(સૂરએ નિસા - આયત ૨૯) અર્થાત્ : અને પોતાની જાતની પોતે જ હત્યા કરીને પોતાનો જીવ ગુમાવશો નહીં (આત્મહત્યા કરશો નહીં) કેમકે બેશક ખુદા-એ-તબારક-વ-તઆલા તમારા ઉપર દયાળુ છે.”

અને એવું પણ ઈશાદિ ફરમાવ્યું છે કે : મન કતલા નફસન - બ - ગયરે - નફસિન - અવફસાદિન ફિલ્અર્હે - ફ - ક - અન્નમા કતલજ્નાસા જમીઅન - વ - મન - અહયાહા - ફ - કઅન્નમા -અહયજ્નાસા - જમીઆ (સૂરએ - માએદાહ - આયત ૩૨) અર્થાત “જો કોઈ વ્યક્તિ કોઈ અન્ય (વ્યક્તિ)ને કોઈ બદલા (કિસાસ) સિવાય અથવા ભૂમિમાં ફસાદ કર્યા સિવાય મારી નાખે તો જાણે સઘળા માણસોને મારી નાંખ્યા અને જેણે એક જીવને જીવતદાન આપ્યું તો જાણે તેણે સઘળા માણસોને જીવતદાન આપ્યું.”



જો કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિ વિશે એવી કોઈ વાત કહે અથવા લખે કે જેને કારણે (ખુદા-ન-ખાસ્તા) અલ્લાહ ન કરે તે બીજો વ્યક્તિ માર્યો જાય. તે સંજોગોમાં તેના ખૂનની સજા તે કહેનાર લખનારને મળશે. તેથી જ એક રિવાયતમાં આવ્યું છે કે “કયામતના દિવસે એક વ્યક્તિ એવી સ્થિતિમાં આવશે કે તેના શરીરે લોહી લાગેલું હશે. તે કહેશે કે ખુદાના સમ! મેં તો કદી કોઈનું પણ ખૂન નથી કર્યું અને કોઈ ના ખૂન (ના બનાવ)માં હું સામેલ પણ નથી થયો” ત્યારે તેને આ વાતનો જવાબ મળશે કે “તે મારા ફલાણા બંદા વિશે એક વાત કહી હતી જે જાહેર થઈ ગઈ અને તેને કારણે તેનું ખૂન થઈ ગયું હતું અને તારા શરીરે તે વ્યક્તિનું જ લોહી લાગેલું છે.”

(વસાયેલુશીઆ-ભાગ-૧- પ્રકરણ-૨  
= હદીસ નં. ૧૭ - ૨૦)

અને આત્મહત્યાને હરામ ઠેરવતી રિવાયતમાં આવ્યું છે કે “મોમિન ઉપર ભલેને કેટલીયે ભારે પરીક્ષાની ઘડી કેમ ન આવી જાય તે આત્મહત્યા નથી કરતો અને વ્યક્તિ જાણી જોઈને આત્મહત્યા કરશે તેને હંમેશા-હંમેશા માટે જહન્નમની આગમાં નાંખી દેવામાં આવશે.”





# આઈ ઝેલેરી

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ


વહાલા બાળકો, અહીં  
આપેલ ચિત્રમાં કુરઆનનો  
સૂરો (સૂર : ફલક)ને ચિત્ર  
દ્વારા દર્શાવવામાં આવેલ છે,  
હવે તમે તેની અંદર સુંદર  
મજાના મનગમતા રંગ પૂરો,  
જેથી આખું ચિત્ર ખૂબ જ  
સુંદર લાગશે.

સૂરએ ફલક



قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ١

કહો, હું શરણ માંગુ છું પરોઢના રબનું,





## مِنْ شَرِّ مَا خَلَقَ ﴿٢﴾

દરેક તે વસ્તુની બુરાઈથી જે તેણે પેદા કરી છે,



## وَمِنْ شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ﴿٣﴾

અને રાત્રિના અંધકારની બુરાઈથી જ્યારે તે છવાઈ જાય,







વહાલા બાળકો, આ પાનું તમારું રહેશે. તમે કોઈ ધાર્મિક વાર્તા, કાવ્ય પંક્તિ, ચિત્ર કે દુયકો વિગેરે મોકલશો. જેથી તમારું પોતાનું આ પાનું ભર્યું ભર્યું રહે !

**સાથે આપનું નામ, સરનામું, ઉંમર લખવાનું ભૂલતા નહીં !**

[illegible]

નકવી સરફરાજ હુસૈન, નકવી અલી નવાઝ,  
નકવી બાબુલ મહેંદી  
હાજી-નાજી ખોડીંગના બાળકો, ભાવનગર.

Page: 1  
 Date: 28/04/20

# શાલિની

ફૂલો છે ગુલાબના ડાહ્યા હયા હામડી  
 એ જમાડુ જ પડે ઉંચાડી કીટગી હયા હામડી.

ફૂલો છે ગુલાબના એ સ્વંગ લીયા હયો  
 અલમ છે અલ્લાસાહા અમ લીયા હયો.

ફૂલો જાણ છે લેડીન ગુલાબ કૈયો નહીં છે  
 જરા ફૂલો જાણ છે લેડીન અલ્લાસા કૈયો નહીં છે

બોરી હાલોડી લામળા હોલી છે ઉંચાડી દલ હલે છે.  
 લાંઠ મહા પામી પીલે છે ઉંચો દરીયા હલે છે.  
 દરીયા જો મેં પામી પીલા લાવે ઉંચો અલ્લાસા હલે છે.

અળી છે નામ અંજી જાણે જાતે છે  
 અંજી યડીન નહીં પાતો ફૂલ મંતે છે.  
 દરીયાતે હાલે ફૂલ ફૂલ લેઈ નહીં  
 ફૂલો છે નામ અંજી અમડું લોટ મંતે છે.

નામ: શાલિની, શાલિની રજા હૈંદર અંજી.  
 નામ: શાલિની, શાલિની અંજી અંજી અંજી અંજી.  
 શાલિની: હૈંદર  
 અંજી: શાલિની નામ

ગા. નં: 1. હોળી ઉમર પંચાત.

NO. 7

Diva

**જમાણી શાફીન રઝા હૈદરઅલી**  
નુતનનગર, ઉના.

788 92 110  
99 12 110

- ન - વીલાસી બાલકુમ - ન -

આપણે જાણીએ છીએ કે આ કિલ્લામાં આપણે હાલ  
માસિક કિલ્લા ખુબ જ સારું છે. આ લોકો કિલ્લા વી મો  
ખુબ જ સારું આવે છે. હું એમ માનું છું કે આ કિલ્લામાં (કેટલા) ખુબ જ  
પુરાણ છે. આ કિલ્લા વી મો હિમાચલ પ્રદેશમાં છે. સરકાર  
મદિના વી હિમાચલ પ્રદેશ મો મદિના મો છે. આ કિલ્લામાં  
આ મદિનામાં જેમકે સરકારમાં કોઈ સરકાર છે તેમ પણ  
માણસ મો છે.

દેશ - અમારો લોકો આપણે ખુબ જ સારું આવે. અને  
હાલ માસિક જે કામ થાયું આવે અને હાલ માસિક સમાવેશ  
અમારો જે લોકો કિલ્લા આવે. અને લોકો કોઈ ના સારા  
સરકારી વી અમારો પુરાણ આવે. લોકો કિલ્લા વી દેશ આવે.

ગામ - સરકારી સેવા, સેમ.

દોરણ - 7<sup>મ</sup> (80)

મોજા - 90 95 36 41 44

ગામ - સામગ્રી (વસ્તી)

પિત્ત - 96 400 1

કરમ તો - 23 - 12 - 1398

સરકાર - સામગ્રી

પરજાના નામ

BEN

રવજાણી મેરાજ એમ.  
ભાવનગર.

[illegible]

દેવજાણી સાબીર એમ.  
નાગલપર, અંજાર.



# બાળકોની કાચરી

વહાલા બાળકો, આ પાનું તમારું રહેશે. તમે કોઈ ધાર્મિક વાર્તા,  
કાવ્ય પંક્તિ, ચિત્ર કે દુચકો વિગેરે મોકલશો. જેથી તમારું  
પોતાનું આ પાનું ભર્યું ભર્યું રહે !


સાથે આપનું નામ, સરનામું, ઉંમર લખવાનું ભૂલતા નહીં !




દેવજાણી સાબીર હુસેન આર.  
અંજાર (કચ્છ)



રવજાણી ફજલ મુનીર અબ્બાસ  
સુલેમાન ખાકુ પાર્ક સોસાયટી, રાજુલા.



મિઠવાણી સજ્જાદ રઝા એચ.  
જુવાબાવાનો ચોક, રાજુલા.



લાખાણી મેહમુદ અબ્બાસ ઝેડ.  
મોચી ચોક.



# ડ્રાઇવિંગ વખતે

## મોબાઇલ પર

### પ્રતિબંધ કેમ છે ?



વાહન ચલાવતી વખતે મોબાઇલ પર પ્રતિબંધ મુકવા પાછળ વિજ્ઞાન પણ છે. વાહન ચલાવવાના અને મોબાઇલ પર વાત કરવાના એમ બે સંકેતો મગજને પ્રાપ્ત થાય છે. મગજ બંનેને સરખો ન્યાય આપી શકતું નથી. કેમકે બંને કેસમાં અમલીકરણ પરસ્પર જુદી પ્રતિક્રિયા દ્વારા કરવાનું રહે છે. તકલીફ એ થાય છે કે ક્યા સંકેતને પ્રધાન્ય આપવું એ વાહનચાલક નક્કી કરી શકતો નથી. પસંદગીનું કામ મગજનું છે અને મગજની પણ અમુક મર્યાદા છે. તેથી અકસ્માત સર્જવાની શક્યતા જોતાં પૈજ્ઞાનિક રીતે પણ આ કાયદો જરૂરી ગણાય છે. એક પ્રયોગમાં જણાયું કે માત્ર એક જ કાર્ય ડ્રાઇવિંગ પર વ્યક્તિનું ધ્યાન કેન્દ્રીત રહે તો તેનો 'રિએક્શન ટાઇમ' ૦.૧૮૬ સેકન્ડ હોય છે. પણ એ સમયે તે વ્યક્તિ મોબાઇલ પર વાત કરતી હોય ત્યારે શારિરીક પ્રતિક્રિયા દાખવવામાં તે ૦.૨૮૯ સેકન્ડ જેટલો સમય લે છે. આમ લગભગ ૫૫% વધુ સમય લાગે. જેને લીધે અકસ્માત થવાની તક એટલાજ પ્રમાણમાં વધી જાય. ધારો કે ૬૦ કિ.મી.ના વેગથી વાહન ચલાવતી વખતે મોબાઇલ પર વાત ચાલતી હોય તો અકસ્માત રોકવા બ્રેક પેડલ દબાતા



સુધીમાં વાહન ૧.૮ મીટર જેટલું અંતર કાપી નાખે અને રસ્તો ઓળંગતા રાહદારી અને વાહન વચ્ચે અંતર ના હોય તો આટલો નજીવો તફાવત પણ ક્યારેક અકસ્માતનું કારણ બની શકે.



# એરકન્ડિશનરનો ફિલિંગ પાવર ટનમાં કેમ છે ?



એરકન્ડિશનર એ ઉષ્મા (ગરમી)ને નાબૂદ કરતું યંત્ર છે. બંધ ઓરડામાં રહેલી હવાની ગરમીને શોષી લેવાનું તે કામ કરે છે અને બ્રિટીશ થર્મલ યુનિટ (બી.ટી.યુ.)માં મપાય છે. ધારો કે ઓરડામાં ૧ ઘનફૂટ રાંધણ ગેસ બાળ્યો હોય તો એ દહન ૧૦૦૦ બી.ટી.યુ. બહાર કાઢે છે. આ ગરમી બરફના એક નાના ટુકડાને બહુ જલદી ઓગાળી નાખે. જો બરફનો ટુકડો ૧ ટનનો હોય તો ૨૪ કલાકમાં તેને ઓગાળી નાખવા માટે અંદાજે ૨૮૮૦૦૦ બી.ટી.યુ. જેટલી ગરમી જરૂરી છે. એટલે કે ૧ કલાકના ૧૨૦૦૦ બી.ટી.યુ. થાય. એટલે એરકન્ડિશનરનું મોડેલ દર કલાકે ઓરડામાંની ૧૨૦૦૦ બી.ટી.યુ. ગરમીને ખેંચી બહાર ફેંકી શકે તે ૧ ટનની ક્ષમતાનું ગણાય છે. જો ૨ ટનનું એરકન્ડિશનર હોય તો એ દર કલાકે ૨૪૦૦૦ બી.ટી.યુ. ગરમી બહાર કાઢે છે.

## "હાદી" માસિકના મેમ્બર બનવા માટે સંપર્ક કરો :

અમદાવાદ	: (૧) શાહીરભાઈ નુરાની ફોન : ૯૩૭૬૧ ૬૮૩૦૬ (૨) મોલાના ઝફરુલ હસન ફોન : ૯૩૨૭૫ ૩૬૬૩૮ (૩) ઝાકીરભાઈ મોમીન ફોન : ૯૩૨૭૦ ૪૧૩૧૪
ભાવનગર	: મુસ્તાકભાઈ પિરાણી ફોન : ૯૮૨૪૫ ૩૮૧૧૪
મહુવા	: (૧) અબ્બાસભાઈ મિઠાણી એગ્ઝ માર્ટ ફોન : ૯૮૨૪૪ ૯૬૯૪૨ (૨) ભંભેરા મોહમ્મદ હુસૈન જાફરઅલી ફોન : ૯૪૨૮૧૨૩૨૩૩
કાણોદર	: નૌશાદભાઈ, જાફરી ચેનલ ફોન : ૯૯૯૮૭ ૭૩૬૧૧
ભરૂચ	: જાવેદભાઈ ડોસાણી
સેલવાસા	: ગુલામ અબ્બાસભાઈ દેવજાણી ફોન: ૯૮૨૫૯ ૯૯૯૭૮
ધોળકા	: કમરઅલીભાઈ મોમીન
ડેડીયાપાડા	: રિઝવાનહુસૈન અમીરઅલી રાજાણી ફોન : ૯૪૨૭૧ ૭૫૨૩૧
તળાજા	: મોહસીન અલી જી.ભૂરાણી ફોન : ૯૯૧૩૬૦૭૧૧૦
રાજૂલા	: મોલાના હસન મહદી ફોન : ૯૯૦૪૧૪૬૧૧૦
સિહોર	: હસનઅલી વજીરઅલી વસાયા ફોન : ૯૮૭૯૯૬૯૮૬૮
મુંબઈ	: અલઈમાન બુક સેન્ટર (પાલાગલી) ફોન : ૯૮૧૯૦૧૦૨૨૮

**ટુરીંગ એજન્ટ : શાહીરઅલી હસનઅલી પ્રમાણી ફોન : ૯૪૨૬૪ ૬૧૪૯૨**

**નોંધ : સભ્ય તથા એજન્ટ મિત્રોને નમ્ર અરજ છે કે નવા વર્ષનું લવાજમ મોકલી આપવા વિનંતી.**





# HADI MASIK

: Publishers :

**Hauza-e-Ilmiyah Imam Khomani (R.A.)**

Goldenpark, Vatva, Ahmedabad. (Guj.) INDIA - 382440.

Ph. : 079 - 25892786, +91-94266 78614, +91-94266 78612

**E-mail : [hadimasik@yahoo.com](mailto:hadimasik@yahoo.com)**

**Website : [www.hadikids.org](http://www.hadikids.org)**

Printed by : PRINTWELL PRINTERS, Ahmedabad. (M) 9898001474

